



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં નવેમ્બર 1 થી અમલમાં આવતા ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 19, 2021) – સેવા વિશ્વાસપાત્રતા સુધારવા અને આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ શહેરની આસપાસ લોકોને કાર્યક્ષમ રીતે હેરફેર કરાવી શકતી હોવાની ખાતરી કરવા, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં નીચેના ફેરફારો નવેમ્બર 1 થી અમલમાં મૂકશે:

501 ઝુમ સ્વીન

- બ્રેમલી ટ્રાન્ઝિટ ટર્મિનલથી વીક્ટોરિયામાં (અઠવાડિક કામકાજના દિવસોમાં) પૂર્વ તરફી વધારાના સવારે 6:03, 6:13 અને 6:23 વાગ્યે ફેરા ઉમેરવામાં આવશે.

4/4A ચિંગકુસી

- વીક્ટોરિયામાં મોડી સાંજે ઉત્તર તરફી ફ્રિક્વન્સી દર 20 મિનિટથી વધારીને દર 15 મિનિટની કરવામાં આવશે.
- વીક્ટોરિયામાં મોડી સાંજે ઉત્તર તરફી ફેરામાં બ્રેમ્પટન ગેટવે ટર્મિનલથી રાત્રે 11:45, મધરાતે 12:00, મળસ્કે 12:11, 12:15, 12:30, 12:45, 1:00, 1:15 અને 1:30 વાગ્યે ઉમેરવામાં આવશે.

5 બોવેર્ડ

- શનિવાર અને રવિવારની સેવા વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ બનાવવામાં આવી છે.

11 સ્ટીલ્સ

- મેપલ લોજ ફાર્મસથી પૂર્વ તરફી બપોરના હાલના 2:20 વાગ્યાના ફેરામાં અનુકૂળ ફેરફાર કરીને સેવાની શરૂઆત વિસગર GO સ્ટેશનથી બપોરે 2:13 વાગ્યે કરવામાં આવશે.

18 ડિક્સી

- બ્રેમલી ટ્રાન્ઝિટ ટર્મિનલથી વીક્ટોરિયામાં (અઠવાડિક કામકાજના દિવસોમાં) દક્ષિણ તરફી વધારાના સવારે 06:15, 07:26 અને 07:40 વાગ્યે ફેરા ઉમેરવામાં આવશે.

26 માઉન્ટ પ્લેઝન્ટ

- વીક્ટોરિયામાં મોડી સાંજની ઘટાડેલી સર્વિસ ફરી શરૂ કરાઈ છે.
- માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ સ્ટેશનથી ઉત્તર તરફી વીક્ટોરિયા પ્રસ્થાનમાં આ સમયો ઉમેરવામાં આવ્યા છે – રાત્રે 8:10, 8:50, 9:30, 10:10 અને 10:50.
- ક્લોકવર્ક ડો. અને ચિંગકુસી રોડથી દક્ષિણ તરફી વીક્ટોરિયા પ્રસ્થાનમાં આ સમયો ઉમેરવામાં આવ્યા છે – રાત્રે 8:27, 9:07, 9:47 અને 10:27.

COVID-19 સુરક્ષા ઉપાયો

આપણું COVID-19 માંથી પસાર થવાનું ચાલુ છે ત્યારે, અમે સવાર (રાઈડર) અને કર્મચારીના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને શક્ય એટલી શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનો હેતુ રાખીએ છીએ. ઘરે રહેવાનો હુકમ સમાપ્ત થયો હોવા છતાં, COVID-19 આપણાં સમુદાયમાં રહ્યો છે અને આપણે પીલ પબ્લિક હેલ્થ પૂરી પાડેલી માર્ગરેખાઓને વળગી રહીને સચેત રહેવું રહ્યું. સેવા પ્રભાવિત થઈ શકે અને રદકરણ થઈ શકે છે, તેથી અમે આ સમય દરમિયાન તમારી ધીરજની કદર કરીએ છીએ.

પ્રવાસ કરતી વખતે, બસમાં અને ટર્મિનલ પર ચુસ્ત-બંધ બેસતો મારસ્ક પહેરો, અને તબીબી કટોકટી હોય તે સિવાય અવરજવર કરતી વખતે કંઈક ખાવા કે પીવા તમારો મારસ્ક નીચો કરવાનું ટાળો. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરીને, તમારા હાથ વારંવાર ધોઈને, અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવીને તમે પોતાને અને અન્ય લોકોને સુરક્ષિત રાખો.

વધારે સારું સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય દર 48 કલાકે તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજાંઘા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.



સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ, ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો, અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્સિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈથ (Prabhjot Kainth)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca